

B.Ed. Semester - 2 (CBCS) Examination
March/April – 2026 (New Course)
Accountancy Content (GROUP A CONTENT-1)

Time: 1:15 Hours

Marks:35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો.

(૦૫)

- 1) મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ એટલે શું?
- 2) ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે ?
- 3) ગુપ્ત અનામત એટલે શું?
- 4) વોરફેજ એટલે શું ?
- 5) કઈ પદ્ધતિ હિસાબો લખવા માટેની ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે ?

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર આપો. (6 માંથી 5)

(૧૦)

- 1) ભરપાઈચૂક એટલે શું?
- 2) ઘસારાપાત્ર મિલકતો એટલે શું?
- 3) મૂડીનફાનાં ચાર ઉદાહરણ આપો.
- 4) કાયું સરવૈયું અને પાકું સરવૈયું વચ્ચેનો તફાવત સમજાવો.
- 5) 'સુડિયું' કે 'દનિયું' તરીકે કોને ઓળખવામાં આવે છે?
- 6) બજારમાં મળતા કેટલાંક તૈયાર ઉપલબ્ધ હિસાબી સૉફ્ટવેરનાં નામ જણાવો.

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર આપો. (6 માંથી 5)

(૨૦)

- 1) વીસરચૂક એટલે શું ? તે કેવી રીતે સુધારવામાં આવે છે, તે ઉદાહરણ આપી સમજાવો.
- 2) એક યંત્ર તા.1-4-08ના રોજ ખરીદવામાં આવ્યું હતું. તા. 1-4-14ના રોજ યંત્ર ખાતાની શરૂની બાકી ₹ 28,000 છે. યંત્ર પર 10 % લેખે સરખા હપતાની પદ્ધતિએ ઘસારો ગણાય છે. રુદ્રના ચોપડે તા. 31-3-15ના રોજ ઘસારાની આમનોંધ લખો.
- 3) નીચે દર્શાવેલ રકમો નફામાંથી ફાળવવામાં આવી છે, તે અનામત છે કે જોગવાઈ તે જણાવો:
 - (1) શકમંદ લેણાં અનામત
 - (2) ડિબેન્ચર પરત નિધિ
 - (3) ઘસારા ભંડોળ
 - (4) કામદાર અકસ્માત વળતર ભંડોળ
- 4) પાકા સરવૈયાના હેતુઓ જણાવો.
- 5) દેશી નામાપદ્ધતિમાં માલપરતના વ્યવહારોની નોંધ કેવી રીતે થાય છે, તે સમજાવો.
- 6) હિસાબો તૈયાર કરવાની પ્રણાલિકાગત પદ્ધતિ અને કમ્પ્યુટર આધારિત હિસાબી પદ્ધતિ વચ્ચેના તફાવતો જણાવો.

ENGLISH VERSION

Que.1 Answer each of the following in brief. (05)

- 1) What is error of commission?
- 2) Depreciation is what kind of expense of business?
- 3) What is secret reserve?
- 4) What is Wharfage?
- 5) Which is the oldest Indian method of writing books of accounts?

Que.2 Give answer of any 5 from the following 6. (10)

- 1) What is compensatory errors?
- 2) What are depreciable assets?
- 3) Give four illustrations of capital reserve.
- 4) Explain the difference between Trial Balance and Balance sheet.
- 5) what is called 'Sudiu' or 'Daniu'?
- 6) State names of some readymade accounting software available in the market.

Que.3 Answer any 5 from the following 6 in detail: (20)

- 1) What is errors of omission? How to rectify these errors? Explain with illustration.
- 2) One machine was purchased on 1-4-08. On 1-4-14 the opening balance of machine account is ₹ 28,000. Depreciation on machine is charged at 10% under straight line method. Write journal entry for depreciation on 31-3-15 in Rudra's book.
- 3) Balances mentioned below are appropriated from profit. State whether it is reserve or provision:
 - (1) Bad debts reserve
 - (2) Debenture redemption fund
 - (3) Depreciation fund
 - (4) Workers accident compensation fund
- 4) Explain the objectives of Balance sheet.
- 5) Explain, how the transactions of goods return are recorded in Deshi Nama System.
- 6) State the differences between the traditional manual system and computerised accounting system.
